

અમારી COVID-19 વેક્સિન સપોર્ટ સર્વિસ

NHSના ઇતિહાસમાં COVID-19 એ એકમાત્ર સૌથી મોટામાં મોટી જાહેર સ્વાસ્થ્ય કટોકટી રહી છે.

COVID-19 વેક્સિનેશન તમને COVID-19 ના રોગથી ચેપગ્રસ્ત થવાની સંભાવના ઘટાડશે. બધી જ દવાઓની જેમ, કોઈ પણ વેક્સિન સંપૂર્ણપણે અસરકારક હોતી નથી અને વેક્સિન લીધા બાદ તમારા શરીરને સુરક્ષા નિર્માણ કરવામાં થોડા અઠવાડિયા લાગે છે. કેટલાક લોકોને વેક્સિનેશન લીધા બાદ પણ COVID-19 થઈ શકે છે, પરંતુ આ કોઈપણ ચેપની તીવ્રતાને ઘટાડશે.

વેક્સિન તમને COVID-19 ચેપ આપી શકતી નથી, અને બે ડોઝ તમારી ગંભીરપણે બીમાર થવાની સંભાવનાને ઘટાડશે. સરકારના માર્ગદર્શનનું પાલન તમારે હજુ પણ કરવું પડશે. બધી જ દવાઓની જેમ, વેક્સિન પણ આડઅસરોનું કારણ બની શકે છે. આમાંની મોટાભાગની આડઅસરો હળવી અને ટૂંકા સમયગાળા માટેની હોય છે, અને તે દરેક વ્યક્તિને થતી નથી.

તમારા વેક્સિન માટે NHS અથવા GP આમંત્રણ

આવનારા અઠવાડિયાઓમાં તમને તમારું વેક્સિન બુક કરાવવા વિશે જણાવતો એક પત્ર મળશે.

પત્ર તમને ક્યાં તો ઓનલાઇન બુક કરવા માટે અથવા 119 પર એપોઇન્ટમેન્ટ બુક કરવા અંગે કોલ કરવા આમંત્રણ આપશે.

વેક્સિન સપોર્ટ - અમે કેવી રીતે મદદ કરી શકીએ

એકવાર તમે તમારો સ્વોટ બુક કરાવી લો, અથવા જો તમને બુકિંગ માટે મદદની જરૂર હોય, તો અમે તમને અમારા મોબાઇલ 07754 751 079 પર અમારા હોમ એન્ડ કેર સર્વિસ મેનેજરને અથવા 020 8981 7124 પર અમારા રિસેપ્શનને કોલ કરવા કહીશું.

તમારા વેક્સિનના દિવસે તમને અમારી હોમ એન્ડ કેર ટીમના એક સભ્ય દ્વારા ઉબર કેબમાં તમારા ઘરેથી લેવામાં આવશે અને તમારા વેક્સિનના સ્થળ પર લઈ જવામાં આવશે. તમે તમારું વેક્સિનેશન લો તે દરમિયાન અમે તમારી પ્રતીક્ષા કરીશું અને ત્યાર બાદ અમે તમને પાછા ઘરે લઈ જઈશું. આ સેવા ટાવર હેમ્લેટ્સ, ન્યૂહૅમ, સિટી એન્ડ હૅકની અને વોલથમ ફોરેસ્ટમાં ઉપલબ્ધ છે.

આ સેવા નિ:શુલ્ક હોવાને કારણે તમને કોઈ ખર્ચ થશે નહીં.

અમારી હોમ એન્ડ કેર ટીમ

એજ UK ઈસ્ટ લંડન ના બધા જ કર્મચારીઓ અને સ્વયંસેવકો ઉન્નત ડિસ્ક્વોઝર અને બારિંગ ચેક્સ હેઠળથી

પસાર થાય છે, જેને દર 3 વર્ષે અપડેટ કરવામાં આવે છે.

સર્વિસ માપદંડ

જેમ કે તમે કલ્પના કરી શકો છો કે અમે દરેક મોટી ઉંમરની વ્યક્તિની સાથે જઈ શકીશું નહીં તેથી એક કડક માપદંડનો અમલ કરવામાં આવશે જે નીચે સૂચિબદ્ધ છે:-

- 65 વર્ષથી વધુની ઉંમર હોય સિવાય કે ડિમેન્શિયા (ચિત્તભ્રંશ) અથવા સમાન સ્થિતિનું નિદાન હોય.
- એકલા રહેતા હોય અથવા અન્ય વ્યક્તિ સાથે રહેતા હોય જે સર્વિસના માપદંડને પૂર્ણ કરે છે.
- કોઈ પરિવાર અથવા મિત્રો હોય નહીં જે તેમને સાથે લઈ જઈ શકે.
- તમે શિલ્ડિંગ લેટર પ્રાપ્ત કર્યો છે.

અમે તમારા GP અને/અથવા સ્વાસ્થ્ય અને સામાજિક વ્યાવસાયિક સાથે પુષ્ટિ કરીશું કે તમે સર્વિસના માપદંડને પૂર્ણ કરો છો.

સંદર્ભો

- GP
- સ્વાસ્થ્ય સંભાળ વ્યાવસાયિક
- સામાજિક સંભાળ વ્યાવસાયિક
- સેલ્ફ (પાત્રતાની પુષ્ટિ સ્વાસ્થ્ય અને/અથવા સામાજિક સંભાળ વ્યાવસાયિક સાથે તપાસવામાં આવશે)

એજ UK ઈસ્ટ લંડન એક સ્વૈચ્છિક સંસ્થા છે અને રજીસ્ટર્ડ ચેરિટી છે. સેવાઓ પ્રદાન કરવા અને તેમના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરવા માટે, અમે 50 થી વધુની ઉંમરની વ્યક્તિઓ સાથે અને તેમને માટે કાર્ય કરીએ છીએ.

અમારી સેવાઓમાં શામેલ છે:

- માહિતી અને સલાહ
- તરફદારી
- હોમ એન્ડ કેર સર્વિસીસ
- મૈત્રી કરવી
- ડિજિટલ સપોર્ટ
- લંચ ક્લબ્સ
- હેન્ડપર્સન સર્વિસીસ
- હોસ્પિટલ ડિસ્ચાર્જ સપોર્ટ સર્વિસીસ

અમારી સેવાઓની સંપૂર્ણ શ્રેણી અમારી વેબસાઇટ પર મળી શકે છે

www.ageukeastlondon.org.uk

સર્વિસ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને નીચે આપેલા મોબાઇલ પર હોમ એન્ડ કેર સર્વિસીસ ખાતે મેનેજરને ટેલિફોન કરો:

મોબાઇલ: 07754 751 079

Kay.munns@ageukeastlondon.org.uk

અથવા અમારી હેડ ઓફિસ રિસેપ્શન ટીમ ખાતે અમારો સંપર્ક કરો:

Age UK East London

82 Russia Lane

E2 9LU

ઇમેઇલ: info@ageukeastlondon.org.uk

ટેલિફોન: 020 8981 7124

સવારે 9.30 – સાંજે 5.30

સોમવાર - શુક્રવાર

અન્ય સમયે આન્સરફોન ઉપલબ્ધ છે

The Organisational Quality Standards are endorsed by the Charity Commission

SERVICES FOR CHARITIES

Age UK Organised Quality Standard

age advice quality standard

Age UK Information & Advice Quality Assured

disability confident COMMITTED

Advocacy QPM AWARD

East London
ageUK

Covid-19
વેક્સિન સપોર્ટ સર્વિસ

